



ધી વેરાવળ પીપલ્સ કો-ઓપ. બેંક લી.

વહીવટી ઓફીસ : “વૃંદાવન”, શુભમ ટાવર્સ સામે, બસ સ્ટેશન પાસે, વેરાવળ.

ફોન : ૨૪૪૦૭૭, ૨૨૧૨૦૧, ૨૪૪૧૨૨ ફેક્સ : ૨૪૪૧૨૩ email : headoffice@vpc.bank.in- www.vpc.bank.in

**કોર બેંકીંગ સુવિધાથી સજ્જ, SMS ALERT, MISS CALL બેલેન્સ ક્વેરી, Mobile App.,
Rupay ATM / Debit Card, UPI, IMPS, QR Code વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ...**

રજીસ્ટ્રેશન નં. ૩૧ ૩૬
તા. ૩૧-૧૦-૧૯૫૯

૬૭મો વાર્ષિક અહેવાલ
૨૦૨૫-૨૦૨૬

રીઝર્વ બેંક લાયસન્સ નં.
UBD. GJ 811 P તા. ૨૯-૧૨-૧૯૮૬

: નોટીસ :

આથી બેંકના સભાસદોને જાણ કરવામાં આવે છે કે, બેંકની ૬૭મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૬-૦૭-૨૦૨૬ રવિવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે શ્રીમતી મણીબેન કોટક હાઈસ્કૂલની “પીપલ્સ બેંક પ્રાર્થના મંદિર હોલ,” વેરાવળ મુકામે નીચે જણાવેલ કામકાજ કરવા માટે મળશે જેમાં સર્વે સભાસદોને સમયસર હાજર રહેવા વિનંતી છે.

: કાર્યસૂચિ :

૧. ગત તા. ૭/૮/૨૦૨૫ ની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવા બાબત.
૨. સને ૨૦૨૫-૨૦૨૬ નાં ઓડિટેડ નાણાંકીય પત્રકો, ઓડિટ દુસ્તી તથા વ્યવસ્થાપક સમિતિનો અહેવાલ વિચારણામાં લઈ બહાલ રાખવા બાબત.
૩. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભલામણ કરેલ અહેવાલના વર્ષના નફાની ફાળવણી મંજૂર કરવા બાબત.
૪. સને ૨૦૨૬-૨૭ ના વર્ષ માટે સ્ટેચ્યુટરી ઓડીટર્સની નિમણૂંકની નોંધ લેવા બાબત.
૫. વ્યાજ રાહત યોજના અન્વયે થયેલ કાર્યવાહીને બહાલી આપવા અંગે.
૬. ખાલી પડેલી ડિરેક્ટર્સની જગ્યા ઉપર કો-ઓપ્ટ. કરેલ ડિરેક્ટરની નિમણૂંકને બહાલી આપવા બાબત.
૭. પેટાનિયમ સુધારા-વધારા બાબત / તેમજ મંજૂર થઈને આવેલ પેટા નિયમ વંચાણે લેવા બાબત.
૮. ચેરમેનશ્રીની મંજૂરીથી અન્ય આવશ્યક કામકાજ બાબત.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સના આદેશથી....

તા. ૨૪-૦૬-૨૦૨૬

(નરેન્દ્ર બી. શીંગાળા)

જનરલ મેનેજર CEO (I/C)

ધી વેરાવળ પીપલ્સ કો-ઓપ. બેંક લી. વેરાવળ

--: નોંધ ::--

- ૧) સંક્ષિપ્ત વાર્ષિક અહેવાલની નકલ સાધારણ સભામાં સાથે લાવવા વિનંતી છે.
- ૨) સાધારણ સભામાં સભ્યોએ ઓળખકાર્ડ સાથે લાવવા વિનંતી છે.
- ૩) સભા અધ્યક્ષની મંજૂરી સિવાય ઉપરમાં જણાવેલ એજન્ડા સિવાય અન્ય કોઈપણ પ્રકારની ચર્ચા હાથ ધરવામાં આવશે નહીં.
- ૪) તા. ૨૯-૦૯-૯૬ ની વાર્ષિક સાધારણ સભાએ મંજૂર કરેલ ઠરાવ અનુસાર આ નોટીસથી અહેવાલના વર્ષના સંક્ષિપ્ત નાણાંકીય હિસાબો મોકલેલ છે. આમ છતાં જે કોઈ સભાસદોને વિશેષ માહિતીની આવશ્યકતા હોય તેઓને વિસ્તૃત વાર્ષિક અહેવાલ બેંકની વેબસાઈટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકશે.
- ૫) બેંકના અહેવાલના વર્ષના વાર્ષિક હિસાબોના સંક્ષિપ્ત અહેવાલ SMS લીંકથી આ નોટીસ મોકલાયેલ છે. વિસ્તૃત વાર્ષિક અહેવાલની નકલ લેખિત માંગણી કર્યેથી રૂબરૂ બેંકની કચેરીએથી ઉપલબ્ધ રહેશે તેમજ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે. જેના ઉપરાંત સભાસદશ્રીઓ ગુજરાત રાજ્ય સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૩૩ ના પ્રાવધાન મુજબની જ માહિતી મેળવવા હક્કદાર છે જેની ખાસ નોંધ લેશે.

અલ્પાહારનો સમય

સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ કલાક સુધીનો રાખવામાં આવેલ છે.

જેથી તે સમય દરમિયાન સર્વ સભાસદશ્રીઓને અલ્પાહારનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.

કુલ આવક, કુલ જાવક જોગવાઈઓ અને નફો

	૨૪-૨૫ (રૂલાખમાં)	૨૫-૨૬ (રૂલાખમાં)
કુલ આવક	૩૮૬૧.૮૫	૩૭૫૬.૮૯
કુલ જાવક	૩૦૯૯.૭૫	૩૧૯૭.૨૫
ગ્રોસ નફો	૭૬૨.૧૦	૫૫૯.૬૪
જોગવાઈઓ	૨૨૩.૯૨	૧૬૫.૨૩
કાર્યકારી ચોખ્ખો નફો સરવૈયામાં લઈ જતા.....	૫૩૮.૧૮	૩૯૪.૪૧

બેંકની પ્રગતિના આંકડા

રકમ (રૂ લાખમાં)

અનુ. નં.	વિગત	વર્ષ				
		૨૦૨૧-૨૨	૨૦૨૨-૨૩	૨૦૨૩-૨૪	૨૦૨૪-૨૫	૨૦૨૫-૨૬
૧	સભાસદ સંખ્યા	૩૧૪૪૪	૩૧૫૧૧	૩૧૫૩૧	૩૧૬૩૪	૩૧૭૨૨
૨	શેર ભંડોળ	૭૯૩.૫૦	૮૯૭.૪૦	૯૯૮.૩૪	૧૦૪૦.૮૬	૧૦૭૪.૪૫
૩	રિઝર્વ તથા અન્ય ફંડ	૨૪૯૨.૮૪	૪૧૦૭.૮૯	૪૪૩૬.૧૪	૪૮૦૨.૪૬	૫૨૨૨.૨૭
૪	થાપણ	૩૫૫૭૫.૭૬	૩૬૮૦૦.૬૬	૩૭૯૪૪.૩૦	૩૯૧૯૧.૦૦	૪૧૮૦૫.૦૯
૫	ધિરાણ	૧૭૨૩૬.૯૬	૧૯૪૧૪.૬૧	૨૧૧૧૦.૨૩	૨૨૬૧૦.૫૫	૨૩૨૦૮.૦૯
૬	કામકાજનું ભંડોળ	૪૦૪૮૭.૨૭	૪૩૪૭૪.૪૦	૪૫૪૬૨.૨૭	૪૭૧૭૩.૬૪	૫૦૦૬૨.૬૯
૭	નફો	૪૧૫.૦૦	૪૭૫.૧૧	૫૧૫.૫૫	૫૩૮.૧૮	૩૯૪.૪૧
૮	નેટ એન.પી.એ. %	૦ (ઝીરો)	૦ (ઝીરો)	૧.૮૦ %	૦ %	૧.૩૯ %
૯	ઓડીટ વર્ગ	અ	અ	અ	અ	અ

-:: નફો તથા ફાળવણી ::-

બેંકનો કાચો નફો રૂ. ૫૫૯.૬૪ લાખ જેમાંથી ઇન્વેસ્ટમેન્ટ ડેપ્રીએશન રીઝર્વ (આઈડીઆર) ૪૪.૨૩ લાખ, ભરવાપાત્ર ઇન્કમેટેક્સ, પ્રોવિઝન સને ૨૦૨૫-૨૬ ના રૂ. ૧૨૧.૦૦ લાખ ચુકવણી કર્યા બાદ ચોખ્ખો નફો રૂ. ૩૯૪.૪૧ લાખ નો થયો છે. જેની વહેંચણી નીચે પ્રમાણે મંજૂર રાખવા બોર્ડ ઓફ ડીરેક્ટર્સ આજની સભાને ભલામણ કરે છે.

૧) પેટા નિયમ ૪૪ અ મુજબ અનામત ભંડોળ ખાતે ૨૫% મુજબ	૯૮,૬૦,૨૬૭.૦૦
૨) સહકારી કાયદાની સુધારેલી કલમ ૬૭-ક મુજબ કુબત અને શંકાસ્પદ લેણા અનામત ખાતે ૧૫% મુજબ	૫૯,૧૬,૧૬૦.૦૦
૩) પેટા નિયમ ૪૪-૬ મુજબ શેર ભંડોળ ઉપર ૧૩% ડીવીડન્ડ	૧૩૪,૪૪,૩૮૦.૦૦
૪) પેટા નિયમ ૪૪-૬ મુજબ શિક્ષણ ફાળો	૩,૦૦,૦૦૦.૦૦
૫) પેટા નિયમ ૪૪-બ મુજબ મેમ્બર્સ બેનીફીટ ફંડ	૪,૦૦,૦૦૦.૦૦
૬) પેટા નિયમ ૪૪-ઇ-૧ મુજબ ચેરીટી ફંડ	૨,૦૦,૦૦૦.૦૦
૭) પેટા નિયમ ૪૪-ઇ-૧ મુજબ સ્ટાફ બેનીફીટ ફંડ	૫,૦૦,૦૦૦.૦૦
૮) પેટા નિયમ ૪૪-ઇ-૪ મુજબ બિલ્ડીંગ ફંડ	૬૦,૦૦,૦૦૦.૦૦
૧૦) પેટા નિયમ ૪૪-ઇ-૧ મુજબ સહકાર, પ્રચાર શિક્ષણ ફંડ	૨૫,૦૦૦.૦૦
૧૨) સાયબર સિક્યુરીટી ફંડ ખાતે	૨૭,૯૫,૨૬૨.૮૧
કુલ રૂપિયા	૩,૯૪,૪૧,૦૬૯.૮૧

ડીવીડન્ડ :- બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ સભાસદોને અહેવાલના વર્ષ માટે ૧૩% લેખે ડીવીડન્ડ આપવાની ભલામણ કરે છે. તે સ્વીકારી બહાલ રાખવા વિનંતી..

વિમા કવચ

બેંકની તમામ થાપણો સામે રિઝર્વ બેંકના નિયમ અનુસાર બેંક દ્વારા દર છ માસે નિયમીત રીતે ભરવાપાત્ર પ્રીમીયમ ભરાયેલ છે. જેના કારણે થાપણદારોની ૫ લાખ સુધીની થાપણો વિમા કવચ હેઠળ સુરક્ષિત છે.



ધી વેરાવળ પીપલ્સ કો-ઓપ. બેંક લી.

તા. ૩૧ મી માર્ચ ૨૦૨૬ નાં રોજનું સંક્ષિપ્ત સરવૈયું

રકમ (₹ લાખમાં)

૩૧-૩-૨૦૨૫	ભંડોળ-દેવું	૩૧-૩-૨૦૨૬	૩૧-૩-૨૦૨૫	મિલ્કત-લેણું	૩૧-૩-૨૦૨૬
૧૦૪૦.૮૬	વસુલ આવેલ શેરભંડોળ	૧૦૭૪.૪૫	૧૧૫૪.૭૬	હાથ ઉપર રોકડ	૧૧૬૪.૬૨
૪૮૦૨.૪૬	રિઝર્વ ફંડ તથા અન્ય ફંડ	૫૨૨૨.૨૭	૨૬૯૫.૫૮	નોટીફાઇડ બેંકોમાં ચાલુ ખાતે	૧૫૦૯.૬૩
૩૯૧૯૧.૦૦	થાપણો	૪૧૮૦૫.૦૯	૧૩૯૯.૩૪	અન્ય બેંકોમાં ચાલુ ખાતે	૧૧૦૧.૫૨
--	કરજ	--	૨૮૮૦.૧૨	બેંકોમાં મુદતી થાપણો	૫૧૫૭.૩૪
--	વસુલાત માટેના બીલ્સ	--	૧૩૫૭૩.૧૨	રોકાણો	૧૫૦૯૧.૮૭
--	બ્રાંચ એડજસ્ટમેન્ટ	--	૨૨૬૧૦.૫૫	ધિરાણ	૨૩૨૦૮.૦૯
૬૧૯.૭૪	મુદતવિતી વ્યાજ અંગે રિઝર્વ	૬૦૬.૨૫	૧.૭૮	બ્રાંચ એડજસ્ટમેન્ટ	૧.૭૮
૭૧૮.૧૯	ચુકવવાપાત્ર વ્યાજ	૭૩૦.૭૯	૯૨૫.૮૯	મળવાપાત્ર વ્યાજ	૯૭૮.૦૩
૨૬૩.૨૦	અન્ય જવાબદારી	૨૨૯.૪૩	--	વસુલાત માટેના બિલ્સ	--
૫૩૮.૧૯	નફા-નુકશાન ખાતે	૩૯૪.૪૧	૧૫૧૪.૬૨	સ્થાવર મિલ્કતો	૧૪૭૬.૭૫
			૧૪૪.૪૨	ફર્નિચર અને ફીક્ચર્સ	૧૩૮.૦૭
			૨૭૩.૪૬	અન્ય અસ્કયામતો	૨૩૪.૯૯
૪૭૧૭૩.૬૪	કુલ સરવાળો	૫૦૦૬૨.૬૯	૪૭૧૭૩.૬૪	કુલ સરવાળો	૫૦૦૬૨.૬૯

તા. ૩૧ મી માર્ચ ૨૦૨૬ નાં રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

રકમ (₹ લાખમાં)

૩૧-૩-૨૦૨૫	ખર્ચ	૩૧-૩-૨૦૨૬	૩૧-૩-૨૦૨૫	આવક	૩૧-૩-૨૦૨૬
૨૨૮૪.૪૨	થાપણ તથા કરજ ઉપર વ્યાજ	૨૩૬૯.૩૨	૩૪૩૪.૯૩	વ્યાજ અને વટાવ	૩૬૦૮.૭૧
૫૩૫.૧૫	પગાર ખર્ચ	૪૯૦.૬૧	૩૬.૩૯	કમિશન - દલાલી	૩૩.૨૨
૭૧.૭૪	ભાડુ, કર, વિમો, તથા ઇલે. ખર્ચ	૭૦.૯૧	--	સીક્યોરીટી ના વેચાણથી	૦.૦૦
૮.૯૪	કોર્ટ - વકીલ ફી	૯.૬૨		થયેલ આવક	
૬.૮૩	પોસ્ટેજ, ટપાલ, ટેલીફોન ખર્ચ	૮.૭૦	૧૪૭.૬૮	અન્ય આવક	૧૧૪.૯૬
૭.૮૧	ઓડીટ ફી	૯.૦૫	૫૮.૨૨	વધારાનું આઈડીઆર પ્રોવિ.	--
૨૯.૦૭	મિલ્કત મરામત તથા ઘસારા ખર્ચ	૩૦.૬૭	૧૮૪.૬૩	વધારાનું એનપીએ પ્રોવિ.	--
૧૦.૯૩	સ્ટેશનરી છાપકામ અને જાહેરાત	૧૨.૦૯			
૧૪૪.૮૫	અન્ય ખર્ચ	૧૯૬.૨૮			
૬૧.૯૨	જોગવાઈ	૪૪.૨૩			
૧૬૨.૦૦	આવકવેરો	૧૨૧.૦૦			
૫૩૮.૧૯	નફો સરવૈયામાં લઈ જતા	૩૯૪.૪૧			
૩૮૬૧.૮૫	કુલ સરવાળો	૩૭૫૬.૮૯	૩૮૬૧.૮૫	કુલ સરવાળો	૩૭૫૬.૮૯
૩૧૮.૨૫	ટ્રાન્સફર બી.ડી.ડી.આર.	--	૫૩૮.૧૯	નેટ નફો	૩૯૪.૪૧
--	ટ્રાન્સફર સ્ટેટ્યુચરી રીઝર્વ	૪૪.૨૩	૩૧૮.૨૫	સ્પેશ્યલ બીડીડીઆર (કો.ઓપ.સો.૬૭-૬)	--
૫૩૮.૧૯	નેટ નફો	૩૯૪.૪૧	--	વધારાનું પ્રોવિઝન (આઈએફઆર)	૪૪.૨૩
૮૫૬.૪૪	સરવાળો	૪૩૮.૬૪	૮૫૬.૪૪	સરવાળો	૪૩૮.૬૪

-:: સભાસદો જોગ કિવિડન્ડ અંગે ખાસ અનુરોધ ::-

બેંક દ્વારા જાહેર કરાયેલા ડીવીડન્ડને જાહેર કર્યાની તારીખથી ત્રણ વર્ષની મુદતમાં વટાવવામાં નહીં આવે તો તે ડીવીડન્ડની વણચૂકવાયેલ રકમ નિયમાનુસાર બેંકના રીઝર્વ ભંડોળ ખાતે જમા લઈ જવામાં આવશે. સભાસદશ્રીઓને વિશેષ અનુરોધ છે કે, બેંક દ્વારા જાહેર કરાતા/ચુકવાતા ડીવીડન્ડની રકમ સીધી પોતાના ખાતામાં જમા મેળવવા હેતુ બેંકની લાગુ પડતી ક્યેરીની મુલાકાત લઈ પોતાના ખાતાની વિગતો શેર વિભાગમાં અપડેટ કરાવવા વિનંતી છે.

--: સભાસદો જોગ વિશેષ - વિનામૂલ્યે રૂ. ૨,૦૦,૦૦૦/- નો અકસ્માત વિમો :-

બેંક દ્વારા હવે તમામ વ્યક્તિ સભાસદોને “ગ્રુપ પર્સનલ એક્સીડન્ટ પોલિસી” હેઠળ કવરેજ આપી રૂપીયા બે લાખ પુરાની રકમનું અકસ્માત વિમા વળતર મળી રહે તે હેતુથી ઓરીયન્ટલ ઇન્સ્યુરન્સ કું. સાથે વ્યવસ્થા ગોઠવેલ છે. સદરહુ અકસ્માત વિમા હેતુ વ્યક્તિ સભાસદની ઉંમર ૧૮ થી ૭૫ વર્ષની રહેશે. સદરહું સભાસદો માટેના વિમાની મુદત વધુ ૧ વર્ષ માટે રીન્યુ કરી આવશ્યક પ્રીમીયમની રકમ ભરી આપવામાં આવેલ છે. સભાસદશ્રીઓને આ અકસ્માત વિમા વળતરનો લાભ વ્યક્તિદીઠ વિમા કંપનીના ધારાધોરણને અનુસરીને મળવાપાત્ર રહેશે. જેની આથી સર્વે સભાસદો જોગ સહર્ષ જાહેરાત કરીએ છીએ. સભાસદશ્રીઓને વિનંતી છે કે, તેઓ પોતાના જરૂરી **KYC** ડોક્યુમેન્ટની નકલો બેંકની લાગુ પડતી કચેરીએ રજુ કરી પોતાની પ્રોફાઇલ અપડેટ કરાવવા વિનંતી..

--: સભાસદો / ગ્રાહકો જોગ નમ્ર નિવેદન :-

બેંક દ્વારા ઇશ્યુ કરાયેલ આપના ATM CUM DEBIT કાર્ડના નંબર, CVV નંબર, OTP, ATM PIN, MOBILE APP. PIN વગેરે કોઈને પણ જણાવશો નહીં. બેંકના કર્મચારીઓ ક્યારેય આવી માહિતી માંગતા નથી. ટેકનોલોજી આધારીત ગુઢાઓની વધતી જતી સંખ્યાઓને ધ્યાને લઈ થોડી સાવચેતી રાખવાથી થનાર મોટા નુકશાનથી બચી શકાશે. આપ પાસેથી બેંકના નામે આવી કોઈપણ વિગતો ફોન પર માંગવામાં આવે તો તુરંત બેંકની લાગુ પડતી કચેરીનો સંપર્ક કરી ચોક્કસ જાણ કરશો.

ગ્રાહકો/સભાસદો જોગ વિશેષ ખાસ સુચના કે, જે સભાસદ/ગ્રાહક બેંક સાથેના તેઓના વ્યવહાર, માહિતીની આપ-લે તેમજ પત્ર વ્યવહાર ઇ-મેઇલ દ્વારા કરવા ઇચ્છુક હોય તેઓએ લાગુ પડતી શાખાની મુલાકાત લઈ પોતાનું ઇ-મેઇલ એડ્રેસ રજીસ્ટર કરાવવા ઘટતી કાર્યવાહી કરવી. બેંકના રેકર્ડ પર નહીં નોંધાયેલા હોય તેવા કોઈપણ ઇ-મેઇલ એડ્રેસ પરથી થયેલા કોમ્યુનિકેશનને ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ સભાસદો/ગ્રાહકોએ લેવા વિનંતી છે.

--: ખાસ સુચના :-

બેંકના અહેવાલના વર્ષના ઓડીટરશ્રી દ્વારા ચકાસાયેલા અને પ્રમાણિત કરેલ વાર્ષિક હિસાબો નિયમાનુસાર પ્રસિદ્ધ કરાયેલ છે. જેનું વ્યક્તિગત રીતે સત્યથી વેગળું તેમજ ભ્રામક, ખોટું અને સંસ્થાની માનહાની કરતું વિશ્લેષણ કરી સોશીયલ મીડીયા દ્વારા કે અન્ય રીતે ચર્ચાઓ કરી સંસ્થાના હિતોને નુકશાન પહોંચાડવાની પ્રવૃત્તિ કરનાર/કરાવનાર સભાસદશ્રી કે અન્ય ની સામે બેંકે લાગુ પડતા કાયદાના પ્રાવધાનો અંતર્ગત પગલા લેવાની ફરજ પડશે જેની ખાસ નોંધ લેશો...

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

શ્રી પ્રકાશભાઈ જગજીવનદાસ તન્ના	ચેરમેન	શ્રીમતી ભૂમિકાબેન ભરતભાઈ ચોલેરા	ડિરેક્ટર
શ્રી રમેશચંદ્ર દ્વારકાદાસ ઠકરા	વાઈસ ચેરમેન	શ્રી હરેશભાઈ હીરાભાઈ ચોપડા	ડિરેક્ટર
શ્રી ઉપેન્દ્રભાઈ રમણીકલાલ તન્ના	ડિરેક્ટર	શ્રીમતી જયશ્રીબેન અશ્વિનભાઈ ઉનડકટ	ડિરેક્ટર, તાલાલા
શ્રી રમેશચંદ્ર જમનાદાસ ગંગદેવ	ડિરેક્ટર	શ્રી પાડલભાઈ પોપટભાઈ કારીયા	ડિરેક્ટર, કેશોદ
શ્રી ભદ્રેશભાઈ જમનાદાસ દાવડા	ડિરેક્ટર	શ્રી હરીશચંદ્ર હરજીવનભાઈ રૂપારેલીયા	ડિરેક્ટર, માંગરોળ
શ્રી સંદિપભાઈ પ્રજલાલ રાયઠઠા	ડિરેક્ટર	શ્રી જયેશકુમાર નારણદાસ ગદા	ડિરેક્ટર, જુનાગઢ
શ્રી જતીનભાઈ ચંદુલાલ રાજા	ડિરેક્ટર	શ્રી દિનેશચંદ્ર ધીરજલાલ દેવાણી	પ્રો. ડિરેક્ટર
શ્રી મુકેશભાઈ રસીકલાલ રૂપારેલીયા	ડિરેક્ટર	શ્રી ભૂવનેશભાઈ છગનલાલ કક્કડ	પ્રો. ડિરેક્ટર
શ્રી સંજયભાઈ બાબુલાલ તન્ના	ડિરેક્ટર	શ્રી નરેન્દ્ર ભાનુલાલ શીંગાળા	જનરલ મેનેજર
શ્રીમતી ભારતીબેન કિશોરકુમાર ચંદ્રાણી	ડિરેક્ટર		CEO (I/C)

બોર્ડ ઓફ મેનેજમેન્ટ

શ્રી મુકેશભાઈ રસીકલાલ રૂપારેલીયા	ચેરમેન
શ્રી ઉપેન્દ્રભાઈ રમણીકલાલ તન્ના	વાઈસ ચેરમેન
શ્રી રમેશભાઈ મુળજીભાઈ કોટક	સભ્ય
શ્રી હરેશભાઈ જેન્તીલાલ કાનાબાર	સભ્ય
શ્રી અલ્પેશકુમાર છોટાલાલ વિઠલાણી	સભ્ય

પેટાનિયમ સુધારા વધારાની દરખાસ્ત

ક્રમ	પેટા નિયમ નં.	જુનો પેટાનિયમ	નવો સુધારેલ પેટાનિયમ	પેટા નિયમ સુધારાના કારણો
૧	૨૧	વાર્ષિક સાધારણ સભા તથા ખાસ સાધારણ સભાની નોટીસ વાર્ષિક સાધારણ સભાની ખબર ૧૪ દિવસ અગાઉ અને ખાસ સાધારણ સભાની ખબર ૭ દિવસ અગાઉ આપવામાં આવશે. એ ખબર ના અંદર સભાની તારીખ, કલાક, જગ્યા અને તેમાં કરવાનાં કામો જણાવવામાં આવશે. વાર્ષિક સાધારણ સભાની સભાસદોને મોકલાવેલી નોટિસ સાથે વાર્ષિક રીપોર્ટ, બેંકનું સરવૈયું તથા નફા-તોટા નો હીસાબ મોકલાવવામાં આવશે. જો કોઈ સભાસદ ને આવી નોટિસ ની જાણ ન થઈ હોય તો પણ તેજ કારણે વાર્ષિક સાધારણ સભા તથા ખાસ સાધારણ સભાનુકામકાજ ગેરકાયદે થઈ શકશે નહીં. વાર્ષિક સાધારણ સભા તથા ખાસ સાધારણ સભાની નોટીસ સભ્યો ને નીચેની રીતો પૈકી કોઈપણ એક રીતે મોકલવામાં આવશે. ૧ કોઈપણ દૈનિક વર્તમાનપત્રમાં પ્રકાશન ધ્વારા અથવા ૨ સભાસદ ના રજી. મોબાઈલ નંબર, રજી. ઈમેઈલ આઈ ડી ઉપર અથવા SMS / WHATSAPP ધ્વારા અથવા ૩ બેંકની સત્તાવાર વેબસાઈટ ઉપર અપલોડ કરીને અથવા ૪ બેંક ની હેડ ઓફીસ તથા શાખાઓના નોટિસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરીને અથવા ૫ હેન્ડ ડીલેવરી ધ્વારા અથવા પોસ્ટ ધ્વારા અથવા કુરીયર ધ્વારા ૬ કોઈપણ અન્ય ઈલે./ડીજીટલ માધ્યમ ધ્વારા	વાર્ષિક સાધારણ સભા તથા ખાસ સાધારણ સભાની નોટીસ વાર્ષિક સાધારણ સભાની નોટિસ ૧૪ દિવસ અગાઉ અને ખાસ સાધારણ સભાની નોટિસ ૭ દિવસ અગાઉ આપવામાં આવશે. એ નોટિસ ની અંદર સભાની તારીખ, સમય, સ્થળ અને તેમાં કરવા નાં કામો જણાવવામાં આવશે. વાર્ષિક સાધારણ સભાની સભાસદોને મોકલાવેલી નોટિસ સાથે વાર્ષિક રીપોર્ટ, બેંકનું સરવૈયું તથા નફા-તોટા નો હીસાબ મોકલાવવામાં આવશે. જો કોઈ સભાસદ ને આવી નોટિસ ની જાણ ન થઈ હોય તો પણ તેજ કારણે વાર્ષિક સાધારણ સભા તથા ખાસ સાધારણ સભાનુકામકાજ ગેરકાયદે થઈ શકશે નહીં. વાર્ષિક સાધારણ સભા તથા ખાસ સાધારણ સભાની નોટીસ સભ્યો ને નીચેની રીતો પૈકી કોઈપણ એક રીતે મોકલવામાં આવશે. ૧ કોઈપણ દૈનિક વર્તમાનપત્રમાં પ્રકાશન ધ્વારા અથવા ૨ સભાસદ ના રજી. મોબાઈલ નંબર, રજી. ઈમેઈલ આઈ ડી ઉપર અથવા SMS / WHATSAPP ધ્વારા અથવા ૩ બેંકની સત્તાવાર વેબસાઈટ ઉપર અપલોડ કરીને અથવા ૪ બેંક ની હેડ ઓફીસ તથા શાખાઓના નોટિસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરીને અથવા ૫ હેન્ડ ડીલેવરી ધ્વારા અથવા પોસ્ટ ધ્વારા અથવા કુરીયર ધ્વારા ૬ કોઈપણ અન્ય ઈલે./ડીજીટલ માધ્યમ ધ્વારા	ગો ગ્રીન પોલીસી ને લાગુ કરવા, સંદેશા વ્યવહાર ના અન્ય વિકલ્પો નો ઉપયોગ કરવા તથા બેંક ની વહીવટી અનુકુળતા માટે
૨	૨૭	બેંકની વ્યવસ્થાપક કમિટી વધુમાં વધુ ૨૧ ડીરેક્ટરો નીચે મુજબ રહેશે. વેરાવળ મતદાર મંડળ સામાન્ય ડીરેક્ટર-૮, મહિલા ડીરેક્ટર-૨, અનુસુચિત જાતિ અથવા અનુસુચિત જનજાતિ-૧, શાખાના ડીરેક્ટર તાલાલા-૧, કેશોદ-૧, માંગરોળ-૧, જુનાગઢ-૧ આ સિવાય જરૂર જણાયે બોર્ડ ઓફ ડીરેક્ટર્સ મતદાર મંડળ માં ફેરફાર કરી શકશે. આ ઉપરાંત બોર્ડ ઓફ ડીરેક્ટર્સ માં કોઈ નિષ્ણાંત ડીરેક્ટરો નહી હોય તો વધુમાં વધુ ૨ નિષ્ણાંત ડીરેક્ટરની કાયદા મુજબ નિયુક્તિ કરવામાં આવશે અને તે કાયદા મુજબના અધિકારો અને ફરજો બજાવશે. બોર્ડ ઓફ ડીરેક્ટર્સમાં અડધાથી વધુ ડીરેક્ટરોની હાજરીનું કોરમ ગણાશે. વાર્ષિક સાધારણ સભા પછીની બોર્ડ ઓફ ડીરેક્ટર્સની બેઠકમાં હાજર ડીરેક્ટરો પોતાના માંથી એક પ્રમુખ તથા એક મેનેજીંગ ડીરેક્ટર તથા એક જોઈન્ટ મેનેજીંગ ડીરેક્ટરને ચુંટી કાઢશે. જે તે પછીની સાધારણ સભા નુ પ્રમુખ સ્થાન પ્રમુખ સંભાળશે. અને તે દરેક બેઠક માં સરખા મત પડે તો એક વિશેષ મત આપી શકશે. તેમજ પ્રમુખશ્રી ની ગેરહાજરીમાં મેનેજીંગ ડીરેક્ટરશ્રી, જોઈન્ટ મેનેજીંગ ડીરેક્ટરશ્રી પ્રમુખ સ્થાન સંભાળશે. તે પૈકી કોઈ હાજર નહી હોય તો બોર્ડ ઓફ ડીરેક્ટર્સ પૈકી કોઈપણ એક ડીરેક્ટર પ્રમુખ સ્થાન સંભાળશે.	બેંકની વ્યવસ્થાપક કમિટી વધુમાં વધુ ૨૧ ડીરેક્ટરોની નીચે મુજબ રહેશે. અને ઘી બેંકીંગ રેગ્યુલેશન એક્ટ-૧૯૪૮ (એમેન્ડમેન્ટ) ૨૦૨૫ ની કલમ ૧૦(એ)(૨) અનુસાર ૧૧ બેઠકો વ્યાવસાયિક અથવા અન્ય અનુભવ ધરાવતા સભ્યો માટે અનામત રહેશે. (૫૧%) વેરાવળ મતદાર મંડળ સામાન્ય ડીરેક્ટર-૮, મહિલા ડીરેક્ટર-૨, અનુસુચિત જાતિ અથવા અનુસુચિત જનજાતિ-૧, શાખાના ડીરેક્ટર તાલાલા-૧, કેશોદ-૧, માંગરોળ-૧, જુનાગઢ-૧ આ સિવાય જરૂર જણાયે બોર્ડ ઓફ ડીરેક્ટર્સ મતદાર મંડળમાં ફેરફાર કરી શકશે. આ ઉપરાંત બોર્ડ ઓફ ડીરેક્ટર્સમાં કોઈ નિષ્ણાંત ડીરેક્ટરો નહી હોય તો વધુમાં વધુ ૨ નિષ્ણાંત ડીરેક્ટરની કાયદા મુજબ નિયુક્તિ કરવામાં આવશે. અને તે કાયદા મુજબના અધિકારો અને ફરજો બજાવશે. બોર્ડ ઓફ ડીરેક્ટર્સમાં અડધાથી વધુ ડીરેક્ટરોની હાજરીનું કોરમ ગણાશે. વાર્ષિક સાધારણ સભા પછીની બોર્ડ ઓફ ડીરેક્ટર્સની બેઠકમાં હાજર ડીરેક્ટરો પોતાનામાંથી એક ચેરમેન તથા એક વાઈસ ચેરમેનને ચુંટી કાઢશે. જે તે પછીની બોર્ડ ઓફ ડીરેક્ટર્સની મીટીંગમાં તથા તે પછીની સાધારણ સભામાં પ્રમુખનું સ્થાન ચેરમેનશ્રી સંભાળશે. અને તે દરેક બેઠક માં સરખા મત પડે તો એક વિશેષ મત આપી શકશે. તેમજ પ્રમુખશ્રીની ગેરહાજરીમાં વાઈસ ચેરમેનશ્રી પ્રમુખ સ્થાન સંભાળશે. તે પૈકી કોઈ હાજર નહી હોય તો બોર્ડ ઓફ ડીરેક્ટર્સ પૈકી કોઈપણ એક ડીરેક્ટર પ્રમુખ સ્થાન સંભાળશે.	બેંકીંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૮ (AACS) ની કલમ 10 A (2) ની જોગવાઈ તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી અર્બન કો-ઓપ-રેટિવ બેંકોને લાગુ કરવામાં આ સુધારો કરવામાં આવે છે.

ક્રમ	પેટા નિયમ નં.	જુનો પેટાનિયમ	નવો સુધારેલ પેટાનિયમ	પેટા નિયમ સુધારાના કારણો
૩	૨૭ બ	ઉમેદવાર જે તે મતદાર વિભાગ/મંડળનો સ્થાનિક રહેવાસી હોવો જોઈએ. જે વ્યક્તિ સભાસદ તા.૩૧મી માર્ચ ના રોજ પુરા થતા વર્ષના પહેલાના સતત ત્રણ હિસાબી વર્ષથી (સહકારી કાયદા ની કલમ ૧૧૫(સી)૧એ મુજબ) અગર તે પહેલા એક શેર ધરાવતો હશે અને ઉમેદવારી કરે તે દિવસે બેંકના સભાસદ તરીકે ચાલુ હશે, પેટા નિયમ ૧૬-અ મુજબની તથા અન્ય કોઈ ગેરલાયકાત નહી ધરાવતા હોય તેમજ આખરી મતદાર યાદીમાં મતદાર તરીકે જેઓનું નામ હશે. અને જેની પાસે ઉમેદવારી નોંધાવી તે દિવસે તેની પાસે કે લાગુ પડતા કાયદામાં દર્શાવેલા સગા-સંબંધીઓની કોઈપણ લોન/ ધિરાણ બાકી નહી હોય અથવા આવા સગા - સંબંધીઓ કોઈ લોન કે ધિરાણમાં જામીનદાર નહી હોય અને આ બેંક કે અન્ય કોઈપણ સહકારી સંસ્થામાં મુળ કરજદાર તરીકે પેઢી યા પ્રોપ્રાઈટરશીપ કન્સર્નના વહીવટ માં વહીવટદાર કે ભાગીદાર તરીકે ધિરાણ પરત આપવાનું ઓવરડ્યુ નહી થઈ ગયું હોય અને જેની સામે નિતીની રૂએ હલકો ગણાતો ફોજદારી ગુન્હો સાબીત થયો નહી હોય તેમજ કોઈપણ કોર્ટએ જેઓને નાદાર ઠરાવ્યા નહી હોય અને જેઓએ રૂ. ૨૦,૦૦૦/- (વીસ હજાર) પુરાની બાંધી મુદતની થાપણ મુકેલી હોય તેજ ઉમેદવારી માટે લાયક ગણાશે. વ્યક્તિ સભાસદની હેસીયત સિવાય પેઢીના ભાગીદાર કે પ્રોપ્રાઈટર શીપ કન્સર્ન ના માલિક તરીકે કંપની યા અન્ય કોઈ નામે શેર જેઓ ધરાવતા હશે તેઓ તે હેસીયતથી ડિરેક્ટર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે નહી કે દરખાસ્ત કરી શકશે નહી. ઉમેદવારી કરનારે રૂ. ૬,૦૦૦/- અનામત જમા કરાવવાની રહેશે. જે કુલ માન્ય રહેલ મતના ૧૦ ટકા અથવા તેથી ઓછા મત મળ્યેથી જપ્ત કરવાને પાત્ર ઠરશે. ચુંટાયેલા/વિજેતા જાહેર થયેલા ઉમેદવારની ચુંટણી ડીપોઝીટ જપ્ત થવાને પાત્ર રહેશે નહી. બેંકનો કોઈપણ પગારદાર કર્મચારી ડીરેક્ટર થઈ શકશે નહી.	ઉમેદવાર જે તે મતદાર વિભાગ/મંડળનો સ્થાનિક રહેવાસી હોવો જોઈએ. જે વ્યક્તિ સભાસદ તા.૩૧મી માર્ચ ના રોજ પુરા થતા વર્ષના પહેલા ના સતત ત્રણ હિસાબી વર્ષથી (સહકારી કાયદા ની કલમ ૧૧૫(સી) ૧એ મુજબ) અગર તે પહેલા એક શેર ધરાવતો હશે અને ઉમેદવારી કરે તે દિવસે બેંકના સભાસદ તરીકે ચાલુ હશે, પેટા નિયમ ૧૬-અ મુજબની તથા અન્ય કોઈ ગેરલાયકાત નહી ધરાવતા હોય તેમજ આખરી મતદાર યાદીમાં મતદાર તરીકે જેઓનું નામ હશે. અને જેની પાસે ઉમેદવારી નોંધાવી તે દિવસે તેની પાસે કે લાગુ પડતા કાયદામાં દર્શાવેલા સગા-સંબંધીઓની કોઈપણ લોન/ ધિરાણ બાકી નહી હોય અથવા આવા સગા-સંબંધીઓ કોઈ લોન કે ધિરાણમાં જામીનદાર નહી હોય અને આ બેંક કે અન્ય કોઈપણ સહકારી સંસ્થામાં મુળ કરજદાર તરીકે પેઢી યા પ્રોપ્રાઈટરશીપ કન્સર્નના વહીવટ માં વહીવટદાર કે ભાગીદાર તરીકે ધિરાણ પરત આપવાનું ઓવરડ્યુ નહી થઈ ગયું હોય અને જેની સામે નિતીની રૂએ હલકો ગણાતો ફોજદારી ગુન્હો સાબીત થયો નહી હોય તેમજ કોઈપણ કોર્ટએ જેઓને નાદાર ઠરાવ્યા નહી હોય અને જેઓએ ત્રણ વર્ષ થી વધુ સમય માટે રૂ. ૨૦,૦૦૦/- (વીસ હજાર) પુરાની બાંધી મુદતની થાપણ મુકેલી હોય અને ધી બેંકીંગ રેગ્યુલેશન એક્ટ- ૧૯૪૯ (એમેન્ડમેન્ટ) ૨૦૨૫ ની કલમ ૧૦(એ)(૨) અનુસાર ની લાયકાત ધરાવતા હશે તેજ ઉમેદવારી માટે લાયક ગણાશે. વ્યક્તિ સભાસદની હેસીયત સિવાય પેઢીના ભાગીદાર કે પ્રોપ્રાઈટર શીપ કન્સર્ન ના માલિક તરીકે કંપની યા અન્ય કોઈ નામે શેર જેઓ ધરાવતા હશે તેઓ તે હેસીયતથી ડિરેક્ટર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે નહી. કે દરખાસ્ત કરી શકશે નહી ઉમેદવારી કરનારે રૂ. ૬,૦૦૦/- અનામત જમા કરાવવાની રહેશે. જે કુલ માન્ય રહેલ મતના ૧૦ ટકા અથવા તેથી ઓછા મત મળ્યેથી જપ્ત કરવાને પાત્ર ઠરશે. ચુંટાયેલા/વિજેતા જાહેર થયેલા ઉમેદવારની ચુંટણી ડીપોઝીટ જપ્ત થવાને પાત્ર રહેશે નહી. બેંક નો કોઈપણ પગારદાર કર્મચારી ડીરેક્ટર થઈ શકશે નહી.	બેંકીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 10 A (2) ની જોગવાઈઓ તા. ૧/૮/૨૦૨૫ થી અર્બન કો-ઓ. બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી આ સુધારો કરવામાં આવે છે.
૪	૨૭ ઈ	વ્યવસ્થાપક કમિટિ પોતાના માંથી એક મેનેજીંગ ડિરેક્ટર નીમશે. તેમજ રોજબરોજ ના કામમાં મદદ કરવા અને કામકાજ માં ધ્યાન આપી શકાય તે માટે વ્યવસ્થાપક કમિટીમાંથી એક બીજા સભ્યની નિમણૂક જોઈન્ટ મેનેજીંગ ડીરેક્ટર તરીકે વ્યવસ્થાપક કમિટિ કરશે.	વ્યવસ્થાપક કમિટિ પોતાના માંથી એક વાઈસ ચેરમેન નીમશે. વાઈસ ચેરમેન ની ફરજો નીચે મુજબ છે. (૧) બેંકના હિસાબો નિયમિત તપાસવાનું (૨) કાગળ પત્રો લખવામાં તથા બેંકના નાણાં સંબંધી વહીવટમાં તથા બીજા સઘળા કામોમાં સેક્રેટરી મેનેજરને સુચનો કરવા. (૩) બેંકના કામકાજમાં જે કંઈ સુધારા વધારાનું કામકાજ કરવા જેવું હોય તે અગર તેમને યોગ્ય જણાય તેવી બીજી કોઈ હકીકત વ્યવસ્થાપક કમિટિના ધ્યાન ઉપર લાવવી. (૪) આ સિવાય વ્યવસ્થાપક કમિટિ જે ફરજ નાખે તથા અધિકાર સોંપે તેને અનુસરીને બેંકનું કામકાજ કરવું.	રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરકયુલર નં. RBI/2025-26/07DoR.HGG.GOV.No.1/18.10.010/2025-2026 તા. ૧-૪-૨૦૨૫ અનુસાર

ક્રમ	પેટા નિયમ નં.	જુનો પેટાનિયમ	નવો સુધારેલ પેટાનિયમ	પેટા નિયમ સુધારાના કારણો
૫	૨૭ (૨)	બેંકીંગ રેગ્યુલેશન એક્ટ, 1949(AACS)ની કલમ 10A(2)ની જોગવાઈઓ તા. ૦૧/૦૮/૨૦૨૫થી અર્બન કો-ઓ.બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી	૨૭(૨) નીચે જણાવેલ વ્યક્તિઓ ડિરેક્ટર તરીકે પાત્રગણાશે નહીં. (૧) જે કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં નોંધ પાત્ર હિત (Substantial Interest) ધરાવતી હોય અથવા કર્મચારી, મેનેજર અથવા મેનેજીંગ ડિરેક્ટર તરીકે સંકળાયેલ હોય જોકે આવી કંપની:- (i) કંપની ઝએક્ટ, 1956ની કલમ 25 હેઠળ નોંધાયેલ કંપની નહોતી, અથવા (ii) એવી કોઈ પેઢી (Firm) સાથે સંકળાયેલ હોય કે જે વેપાર, વાણિજ્ય અથવા ઉદ્યોગ ચલાવતી હોય જે લઘુ ઉદ્યોગ (Small Scale Industrial Concern) ન હોય. (2) કોઈ એવી વેપારી, વાણિજ્યીક અથવા ઔદ્યોગિક સંસ્થાના માલિક હોય કે જે લઘુ ઉદ્યોગ (Small Scale Industrial Concern) તરીકે વર્ગીકૃત ન થતી હોય.	બેંકીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 10A (2) ની જોગવાઈઓ તા. ૧/૮/૨૦૨૫ થી અર્બન કો-ઓ. બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી આ સુધારો કરવામાં આવે છે.
૬	૨૭ (૩)	બેંકીંગ રેગ્યુલેશન એક્ટ, 1949(AACS) ની કલમ 10A(2)ની જોગવાઈઓ તા. ૧/૮/૨૦૨૫થી અર્બન કો-ઓ.બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી	૨૭(૩) જો પેટાનિયમ ક્રમાંક ૨૭ ની પેટાકલમ(૨) મુજબ બોર્ડનું પુનઃગઠન કરવા માટે કોઈ ડિરેક્ટર અથવા ડિરેક્ટરો ને નિવૃત્ત કરવાનું જરૂરી બને તો બોર્ડ ટ્રિટી ઉપાડવાની (Draw of Lots) નિર્ધારિત પદ્ધતિ દ્વારા નક્કી કરશે કે કયા ડિરેક્ટર અથવા ડિરેક્ટરો પદ ઉપરથી નિવૃત્ત થશે. બોર્ડનો આનિર્ણય તમામ ડિરેક્ટરો માટે બંધનકરતા રહેશે.	બેંકીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 10A (2) ની જોગવાઈઓ તા. ૧/૮/૨૦૨૫ થી અર્બન કો-ઓ. બેંકોને લાગુ કરવામાં આવેલ હોવાથી આ સુધારો કરવામાં આવે છે.
૭	૨૮	બોર્ડની સભા અને તેની સત્તા પેટા કાયદા અને સાધારણ સભામાં પસાર કરેલા ઠરાવોને પાત્ર રહીને બેંકનું કામકાજ કરવાની સંપૂર્ણ સત્તા વ્યવસ્થાપક કમિટિને છે, બેંકના કામકાજનો નિકાલ કરવાને કમિટિ વખતો વખત મળશે પણ એક માસમાં ઓછામાં ઓછું એકવાર તો મળવું જોઈએ.	બોર્ડની સભા અને તેની સત્તા પેટા કાયદા અને સાધારણ સભામાં પસાર કરેલા ઠરાવોને પાત્ર રહીને બેંકનું કામકાજ કરવાની સંપૂર્ણ સત્તા વ્યવસ્થાપક કમિટિને છે, બેંકના કામકાજનો નિકાલ કરવાને કમિટિ વખતો વખત મળશે પણ એક માસમાં ઓછામાં ઓછું એકવાર તો મળવું જોઈએ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ૩ દિવસ અગાઉ કરવામાં આવશે સદરહુ મીટીંગની સુચના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના સભ્યોને નીચેનામાંથી કોઈપણ એક રીતે કરવામાં આવશે જેમકે, ૧ ડિરેક્ટર ના બેંક માં નોંધાયેલ રજી. મોબાઈલ નંબર, ૨ રજી. ઈમેઈલ આઈડી અથવા SMS / WHATSAPP દ્વારા અથવા ૩ કોઈપણ અન્ય ઈલે./ડિજીટલ માધ્યમ દ્વારા.	ગ્રીન પોલીસી ને લાગુ કરવા, સંદેશા વ્યવહાર ના અન્ય વિકલ્પો નો ઉપયોગ કરવા તથા બેંક ની વહીવટી અનુકુળતા માટે
૮	૩૩	વ્યવસ્થાપક કમિટિનું કામ અને સત્તા વ્યવસ્થાપક કમિટિનું કામ અને સત્તા નીચે મુજબ છે. ૧) જરૂર જણાય તે પ્રમાણે બેંકમાં મેનેજીંગ ડિરેક્ટર, મેનેજર વિગેરે અમલદારની તથા પગારદાર નોકરોની નિમણૂક કરવા અને તેમને આપવાના ઓનરેરીયમ બોનસ તથા પગાર નક્કી કરવાં અને તેમને સસ્પેન્ડ કરવા, શિક્ષા કરવી અથવા બરતરફ કરવાં પરંતુ થીફ એક્ઝીક્યુટીવ ઓફીસર, પગારદાર મેનેજીંગ ડિરેક્ટર, જનરલ મેનેજરની નિયુક્તિ, બરતરફી, રાજીનામું સહકારી મંડળીઓનાં રજીસ્ટ્રારશ્રીની પૂર્વ મંજૂરી મેળવ્યા પછી વ્યવસ્થાપક સમિતિ કરશે.	વ્યવસ્થાપક કમિટિનું કામ અને સત્તા વ્યવસ્થાપક કમિટિનું કામ અને સત્તા નીચે મુજબ છે. ૧) જરૂર જણાય તે પ્રમાણે બેંકમાં પગારદાર મેનેજીંગ ડિરેક્ટર, જનરલ મેનેજર/થીફ એક્ઝીક્યુટીવ ઓફીસર વિગેરે અમલદારની તથા પગારદાર નોકરોની નિમણૂક કરવા અને તેમને આપવાના ઓનરેરીયમ બોનસ તથા પગાર નક્કી કરવાં અને તેને સસ્પેન્ડ કરવા, શિક્ષા કરવી અથવા બરતરફ કરવાં પરંતુ થીફ એક્ઝીક્યુટીવ ઓફીસર, પગારદાર મેનેજીંગ ડિરેક્ટર, જનરલ મેનેજરની નિયુક્તિ, બરતરફી, રાજીનામું સહકારી મંડળીઓનાં રજીસ્ટ્રારશ્રીની તથા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની પૂર્વ મંજૂરી મેળવ્યા પછી વ્યવસ્થાપક સમિતિ કરશે.	રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરકયુલર નં. RBI/2025-26/07DoR.HG G.GOV.No.1/18.10.010/2025-2026 તા. ૧-૪-૨૦૨૫ અનુસાર

ક્રમ	પેટા નિયમ નં.	જુનો પેટાનિયમ	નવો સુધારેલ પેટાનિયમ	પેટા નિયમ સુધારાના કારણો
૯	૩૬-બ	(બ) જનરલ મેનેજર જનરલ મેનેજરની ફરજો વ્યવસ્થાપક સમિતિ સોંપે તે મુજબ રહેશે.	(બ) ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર ની ફરજો વ્યવસ્થાપક સમિતિ સોંપે તે મુજબ તથા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની વખતો વખતની ગાઈડ લાઈન/પરીપત્રો મુજબ રહેશે.	રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરકયુલર નં. RBI/2025-26/07 DoR. HGG. GOV. No.1/18.10.010/2025-2026 તા. ૧-૪-૨૦૨૫ અનુસાર
૧૦	૩૮ (ફ) ૨ (જ)	હપ્તેથી લોન વસુલ કરવાની હશે તે વ્યવસ્થાપક કમિટિ નક્કિ કરશે. અને જરૂર પડે ત્યારે વધારેમાં વધારે એક વર્ષ માટે મુદત વધારી આપી શકશે. જે હપ્તા માટેની લેણી તારીખથી દસ દિવસની અંદર વસુલ આપવામાં ન આવે તો તેવા હપ્તા ઉપર ઠરાવેલ વ્યાજ ઉપરાંત ૩ ટકા વધુ વ્યાજ શિક્ષા વ્યાજ તરીકે લેવામાં આવશે.	હપ્તેથી લોન વસુલ કરવાની હશે તે વ્યવસ્થાપક કમિટિ નક્કિ કરશે. અને જરૂર પડે ત્યારે વધારેમાં વધારે એક વર્ષ માટે મુદત વધારી આપી શકશે. તેમજ હપ્તા માટેની લેણી તારીખ થી ૧૫ દિવસ ની અંદર હપ્તો વસુલ આપવામાં ન આવે તો તેવા હપ્તાના વ્યાજની રકમ તથા અન્ય તમામ ધિરાણો માં વ્યાજ નિયમિત લેણી તારીખ થી ૧૫ દિવસની અંદર ભરપાઈ ન થાય/ખાતુ ૩૦ દિવસથી વધુ સમયથી રીન્યુ ન થાય તો ઓવરડ્યુ રકમ ઉપર ઠરાવેલા વ્યાજ ઉપરાંત વાર્ષિક ૩% લેખે વ્યાજ પેનલ ચાર્જ/પેનલ ઇન્ટરેસ્ટ તરીકે લેવામાં આવશે.	રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની સુચના થી
૧૧	૩૮ (આઈ) ૫	દરેક સહકારી વર્ષના પ્રારંભે વ્યવસ્થાપક કમિટિ મેનેજીંગ ડિરેક્ટર ની ધીરાણ સગવડ વ્યવસ્થાપક કમિટિની બહાલીની અપેક્ષાએ વધુ મુદત માટે રીન્યુ કરવા માટે અધિકાર આપી શકશે. કેશક્રેડિટ, ઓવરડ્રાફ્ટ અને પ્રોપર્ટી મોર્ગેજ, કેશક્રેડિટ સ્વરૂપની ધિરાણ અરજીઓને જો તેઓનો વ્યવહાર નિયમિત હશે તથા ખાતુ મુદત વિતી નહીં હોય તો મેનેજીંગ ડિરેક્ટર વધુ એક મુદત માટે ધિરાણ રીન્યુ કરી શકશે. આવી રીન્યુઅલ ધિરાણો ની અરજીઓને વ્યવસ્થાપક કમિટીની ત્યાર પછીની મિટીંગમાં બહાલી માટે રજુ કરવી જોઈએ.	દરેક સહકારી વર્ષના પ્રારંભે વ્યવસ્થાપક કમિટિ ચેરમેન/વાઈસ ચેરમેન ને વ્યવસ્થાપક કમિટિની બહાલીની અપેક્ષાએ ધીરાણ સગવડ વધુ મુદત માટે રીન્યુ કરવા માટે અધિકાર આપી શકશે. કેશક્રેડિટ, ઓવરડ્રાફ્ટ અને પ્રોપર્ટી મોર્ગેજ, કેશક્રેડિટ સ્વરૂપની ધિરાણ અરજીઓને જો તેઓનો વ્યવહાર નિયમિત હશે તથા ખાતુ મુદત વિતી નહીં હોય તો ચેરમેન/વાઈસ ચેરમેન વધુ એક મુદત માટે ધિરાણ રીન્યુ કરી શકશે. આવી રીન્યુઅલ ધિરાણો ની અરજીઓને વ્યવસ્થાપક કમિટીની ત્યાર પછીની મિટીંગમાં બહાલી માટે રજુ કરવી જોઈએ.	રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરકયુલર નં. RBI/2025-26/07 DoR. HGG. GOV. No.1/18.10.010/2025-2026 તા. ૧-૪-૨૦૨૫ અનુસાર
૧૨	૪૮	બેંક વતી સહી કરવાનો અધિકાર વિગેરે ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર તેમજ વ્યવસ્થાપક કમિટિ વખતો વખત ઠરાવે તેવી વ્યવસ્થાપક કમિટિના સભ્યો તેમજ બેંકના કર્મચારીઓએ બધા પૈકી ગમે તે બે જણાંની સંયુક્ત સહી થી વહીવટ થઈ શકે તેવા બેંકના નામના ખાતા ખોલી શકાશે અને તેઓ પૈકી ગમે તે બે જણ તેનો વહીવટ કરી શકશે એટલે નાણાંની આપલે કરી શકશે. તેમજ થાપણોની રસીદો ઉપર અને બેંકના બીજા વહીવટમાં ઉપરોક્ત પૈકી ગમે તે જણને સંયુક્ત સહીના અધિકાર રહેશે. ચેક્સ, ડ્રાફ્ટસ, હુન્ડી તેમજ ઈતર બીલો ઉપર બેંક વતી એન્ડોર્સમેન્ટ કરવાને ઉપરોક્ત પૈકી ગમે તે એક જણ સહી કરી શકશે પરંતુ સહકારી અથવા બીજા જામીનગીરીઓ, કોઈપણ જાતની સીકયોરીટીઝ, સહકારી લોન, મ્યુનિ. ડીબેન્ટર્સ બોન્ડો તથા મહે. રજીસ્ટ્રાર સાહેબે મંજૂર કરેલી જોઈન્ટ સ્ટોક કંપનીઓ અગર સહકારી મંડળીઓના શેર વિગેરે ખરીદવા, વહેંચવા, તબદીલ કરવા, ગીરો મુકવા, ગીરો રાખવા તેમજ બેંક તરફથી દસ્તાવેજો દસ્તાવેજો કરવા વિગેરે કામ માટે ઉપર જણાવેલા પૈકી બે જણને સંયુક્ત સહી રહેશે. પરંતુ બે જણમાંથી ચેરમેન તથા મેનેજીંગ ડિરેક્ટર પૈકી એક હોવો જોઈએ.	બેંક વતી સહી કરવાનો અધિકાર વિગેરે ચેરમેન, વાઈસ ચેરમેન તેમજ વ્યવસ્થાપક કમિટિ વખતો વખત ઠરાવે તેવી વ્યવસ્થાપક કમિટિના સભ્યો તેમજ બેંકના કર્મચારીઓ તે બધા પૈકી ગમે તે બે જણાંની સંયુક્ત સહી થી વહીવટ થઈ શકે તેવા બેંકના નામના ખાતા ખોલી શકાશે અને તેઓ પૈકી ગમે તે બે જણ તેનો વહીવટ કરી શકશે એટલે નાણાંની આપ-લે કરી શકશે. તેમજ થાપણોની રસીદો ઉપર અને બેંકના બીજા વહીવટમાં ઉપરોક્ત પૈકી ગમે તે જણને સંયુક્ત સહીના અધિકાર રહેશે. ચેક્સ, ડ્રાફ્ટસ તેમજ અન્ય ફાઈનાન્સીયલ ઇન્સ્ટ્રુમેન્ટસ ઉપર બેંક વતી એન્ડોર્સમેન્ટ કરવા, વટાવવા, નવા ઈસ્યુ કરવા માટે ઉપરોક્ત પૈકી ગમે તે એક જણ સહી કરી શકશે પરંતુ સહકારી અથવા બીજી જામીનગીરીઓ, કોઈપણ જાતની સીકયોરીટીઝ, સહકારી લોન, મ્યુનિ. ડીબેન્ટર્સ, બોન્ડો તથા મહે. રજીસ્ટ્રાર સાહેબે મંજૂર કરેલી જોઈન્ટ સ્ટોક કંપનીઓ અગર સહકારી મંડળીઓના શેર વિગેરે ખરીદવા, વહેંચવા, તબદીલ કરવા, ગીરો મુકવા, ગીરો રાખવા તેમજ બેંક તરફથી દસ્તાવેજો દસ્તાવેજો કરવા વિગેરે કામ માટે ઉપર જણાવેલા પૈકી બે જણને સંયુક્ત સહી રહેશે. પરંતુ બે જણમાંથી ચેરમેન તથા વાઈસ ચેરમેન પૈકી એક હોવો જોઈએ.	રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સરકયુલર નં. RBI/2025-26/07 DoR. HGG. GOV. No.1/18.10.010/2025-2026 તા. ૧-૪-૨૦૨૫ અનુસાર
		શેર ના પ્રમાણપત્ર ઉપર ચેરમેન સહી કરશે તથા મેનેજર, મેનેજીંગ ડિરેક્ટર તેમજ મેનેજીંગ કમિટિના સભ્ય પૈકી કોઈ બે જણ સહી કરશે. આમ ત્રણ જણની સંયુક્ત સહીથી શેરનું પ્રમાણપત્ર આપી શકાશે.	શેરના પ્રમાણપત્ર ઉપર ચેરમેન સહી કરશે તથા વાઈસ ચેરમેન જનરલ મેનેજર/ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર તેમજ મેનેજીંગ કમિટિના સભ્ય પૈકી કોઈ બે જણ સહી કરશે. આમ ત્રણ જણની સંયુક્ત સહીથી શેરનું પ્રમાણપત્ર આપી શકાશે.	